

ત્વરિત જાહેરાત માટે

## જૂન માસમાં COVID-19 દરમિયાન સિટી ઓફ બ્રેમ્પટન પોતાના વૈવિધ્યપૂર્ણ સમાજને વધાવે છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (01 જૂન 2020) – સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઇન કરીને સિટી ઓફ બ્રેમ્પટન COVID-19 ના પ્રભાવ સામે લડત આપીને અનુકૂળ થઈ રહ્યું છે જેમાં જૂનનાં હેરિટેજ માસ અને જૂનની 21 મીના રોજ નેશનલ ઈન્ડિજિનસ પિપલ્સ ડે નો પણ સમાવેશ થાય છે.

### જૂન હેરિટેજ માસ

જૂન મહિનો ફિલિપિનો હેરિટેજ માસ, ઇટાલિયન હેરિટેજ માસ અને પોરચ્યુગીઝ હેરિટેજ માસ તરીકે બ્રેમ્પટન ખાતે ઘોષીત કરવામાં આવેલ છે. આ વર્ષે મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને કાઉન્સિલરો દ્વારા આ પ્રત્યેક સમાજોનું બહુમાન ખાસ વિડિયો સંદેશાથી કરાશે. વિડિયો સિટીના [YouTube](#) અને સોશયલ મિડિયાની ચેનલો પર આખા મહિના દરમિયાન પ્રસારિત થતા રહેશે.

2019 માં સિટીએ બ્રેમ્પટનના વૈવિધ્યનું બહુમાન કરવા માટે કમ્યુનિટી રેકગ્નિશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ વર્ષે રૂબરૂમાં થતી સમૂહ ઉજવણીઓ કરવી શક્ય ન હોવાથી, સિટી બધાને બ્રેમ્પટનના વૈવિધ્યસભર સમાજને વધાવી લેવા અને તેમના વિશે વધુ જાણકારી મેળવવા માટેની આ તક ઝડપી લેવા પ્રોત્સાહિત કરે છે.

### નેશનલ ઈન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય સ્વદેશી લોક દિન) ઉજવો – ઓનલાઇન

નીચેની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બ્રેમ્પટન ખાતેનો નેશનલ ઈન્ડિજિનસ પિપલ્સ ડે જૂન 21 ના રોજ ઉજવો: ભૂલકાઓની પ્રવૃત્તિઓ, પરંપરાગત વ્યંજનો બનાવીને, મેયર બ્રાઉનનું નિવેદન સહિત કાર્યક્રમના પ્રારંભની પ્રાર્થનાના વિડિયો તેમજ જેસી થિસલ (Jesse Thistle) જેવા ઈન્ડિજિનસ સ્કોલરની પ્રસ્તુતિ, પરંપરાગત કાર્યક્રમો, ટ્રિવન ફ્લેમ્સ બેન્ડ (Twin Flames)નું સંગીત અને સમાપન પ્રાર્થના નિહાળો. આ ડિજિટલ ઇવેન્ટ દ્વારા ઈન્ડિજિનસ નેટવર્કની ભાગીદારીમાં આયોજિત કરવામાં આવેલ છે.

ઉજવણીને ઓનલાઇન આ લિંક પર નિહાળી શકાશે [www.brampton.ca/NIPD](http://www.brampton.ca/NIPD).

જીલ્લાઈમાં સીટી ઓફ બ્રેમ્પટન અને પીલ પ્રાઈડ Pride (પ્રાઈડ)ને વધાવશે. આ ઉજવણીની વિગતો આવતા સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે.

## અવતરણો

હું બધાંને બીજી સંકૃતિઓ વિશે જાણકારી મેળવવા તેમજ આપણું વૈવિધ્યસભર શહેર સમાવી લે છે એવા ઘણા બધાં સમાજોને જાણવા ઓળખવા પ્રોત્સાહિત કરું છું. આ વર્ષે અમે કોઈ રૂબરૂ ઉજવણીઓ કરવાના નહીં હોવા છતાં, અમે ઓનલાઈન ઉપલબ્ધ કરેલ ઉજવણીઓમાંથી તમને બ્રેમ્પટનનાં વૈવિધ્યનાં દર્શન થશે અને હા યાદ અપાવીએ કે શારીરિક અંતર જાળવતા રહેશો.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"સીટી ઓફ બ્રેમ્પટન માને છે કે આપણું વૈવિધ્ય જ આપણી સૌથી મોટી શક્તિ છે. સિટી તરીકે અમે જે પણ કરીએ છીએ તેના હાર્દમાં તો જનતા જ છે જેમાં તે સુનિશ્ચિત કરવું સામેલ છે કે આપણા સમાજને સર્જે છે તે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ સાથે પ્રવૃત્ત રહેવું તેમજ મદદરૂપ થવું.

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)

